


દર મહિને પ્રગટ થતું
ગુજરાતી વિશ્વકોશનું સંપર્કપત્ર

વિશ્વવિદ્યા

વર્ષ : 13 * અંક : 05 * ફેબ્રુઆરી 2011 * ક્રિ. રૂ. 5



શ્રી ગંગ્ભીરચંદ ઉમેદચંદ શાહ વિશ્વવિદ્યા શ્રેણીનું
નવું પ્રકાશન

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટનાં પ્રકાશનો

કર્મચારી સ્વ. સાંકળયંદભાઈ પટેલ જીવનઘડતર ગુણ્યશ્રેણી



- (૧) ગુજરાતના સ્વાતંત્ર્યસૈનિકો (માહિતીકોશ) (બીજી આવૃત્તિ), ૪૫૦ રૂ.
- (૨) ભૂરૂપ : માહિતી અને ઘટના, ૧૦ રૂ. (૩) વિરલ વિભૂતિ વિકલ્પ સારાભાઈ, ૧૦ રૂ.
- (૪) મેથાણીયરિટ (બીજી આવૃત્તિ), ૮૦ રૂ. (૫) ગુજરાતની રંગભૂમિ : રિષ્ટ્રિ અને રોનક, ૪૫૦ રૂ.
- (૬) લોકશાલી, ૧૦ રૂ. (૭) પ્રવાસી પિરામિઝનો, ૨૦ રૂ. (૮) જાતીન્દ્ર-વિરોધ, ૨૦૦ રૂ.
- (૯) ડાયનોસોર, ૧૦૦ રૂ. (૧૦) રેલવેની વિકાસગાથા, ૧૦૦ રૂ. (૧૧) રતિ-વિરતિ, ૧૦૦ રૂ.

હાન્દિ ઔંગ આશ્રમ પ્રેરિત સંશોધન કેન્દ્ર



- (૧) હસ્તપ્રતિક્રિયાન, ૨૦૦ રૂ. (૨) અભિનેય નાટકો (ભાગ ૧), ૧૫૦ રૂ.
- (૩) ગુજરાતી ગ્રંથસૂચિ (૨૦૦૬), ૧૫૦ રૂ.
- (૪) ગુજરાતી ગ્રંથસૂચિ (૨૦૦૭), ૧૫૦ રૂ. (૫) વસન્ત-સૂચિ, ૨૫૦ રૂ.

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ વતી મુદ્રક, પ્રકાશક અને તંત્રી કુમારપાળ દેસાઈ,
પ્રકાશનસ્થળ : ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, ૪૧/૨, રમેશપાઈની બાજુમાં, બંધુસમાજ સોસાયટી
સામે, ઉસ્માનપુરા, અમદાવાદ ૩૮૦ ૦૧૩. ફોન : ૨૭૫૫ ૧૭૦૩, મુદ્રણસ્થળ : ભગવતી
નોફ્સેટ, બારડોલપુર, દરિયાપુર દરવાજા બકાર, અમદાવાદ ૩૮૦ ૦૦૪



email : vishvakoshad1@gmail.com • www.vishwakosh.org

છૂટક કિમત ૩. ૫૦, વાર્ષિક લવાજમ ૩. ૫૦/-

લવાજમ : 'ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ'ના નામે ગ્રાફટ અથવા મ.ઓ.થી ૪ મોકલબું.

[અહીં પ્રગત થતાં લખાણોમાંના વિચાર-અભિપ્રાયની જવાબદારી જે તે લોખકની છે.]

ਮੌਧਵਾਰੀਨੀ ਤਪਰੀ ਸਮਝਾ

છેલ્લાં બે વર્ષથી દેશના લોકો ભાવવધારાથી અને ખાસ કરીને આહારની ચીજોના ભાવવધારાથી પીડાઈ રહ્યા છે. કઠોળ, દૂધ, શાકભાજુથી માંડીને આહારની લગભગ બધી જ ચીજોના ભાવમાં મોટો વધારો થયો છે. તેમાં પણ છેલ્લા લગભગ બે મહિનાથી કુંગળીના ભાવમાં જે અકલ્ય વધારો થયો છે તેનાથી લોકો ત્રસ્ત છે. ઓછી આવક ધરાવતા લોકો માટે કઠોળ, દૂધ અને શાકભાજ દોહ્યલાં બન્યાં છે. ગયા વર્ષ અતિ નબળા ચોમાસાને કારણે ખેતપેદાશોના ઉત્પાદનમાં ઘટાડો થવાથી અનાજના ભાવો વધે તે અપેક્ષિત હતું, પરંતુ ચાલુ વર્ષ સારા ચોમાસાને કારણે અનાજના ઉત્પાદનમાં પાંચેક ટકા જેટલો વધારો થવાની ધારણા હોવા ઇતાં આહારની ચીજોના ભાવો કાબુમાં આવતા નથી. આ ભાવવધારાની સમજૂતી રૂપે વિવિધ કારણો રજૂ કરવામાં આવ્યાં છે. પ્રથમ, જાગું તથ્ય નહિ ધરાવતાં, પણ લોકપ્રિય બનેલાં કારણોની ચર્ચા કરીએ.

વેપારીઓ સંઘરાખોરી કરીને ભાવો વધારી મૂકે છે; ખેતપેદાશની જે ચીજોમાં વાયદાનો વેપાર કરવાની છૂટ આપવામાં આવી છે તેમાં સહાખોરીના કારણો એ ચીજોના ભાવો વધે છે, કેટલીક ચીજોના ભાવો તેમની નિકાસને કારણે વધે છે. આ બધાં લોકપ્રિય કારણો છે. સરકાર પડ્યા એને વશ વર્તીને કે ભાવોને ડામવા માટે પોતે કંઈક કરી રહી છે અથું દર્શાવવા માટે સંઘરાખોરી સામે પગલાં ભરતી હોય છે અને નિકાસો સામે બંધી ફરમાવતી હોય છે. આ પ્રકારનાં પગલાં ભરવામાં આવ્યાં છતાં ભાવવધારાને ડામી શકાતો નથી. એમાંથી એ સમજાવું જોઈએ કે ભાવવધારા માટેનાં એ પાયાનાં કારણો નથી. આ મુદ્દાને સમજુએ.

વેપારીઓ જો સંઘરાખોરી કરીને પોતાની છચ્છા પ્રમાણે ભાવો વધારી શકતા હોય તો અનાજ કે આહારની ચીજોના ભાવમાં દર વર્ષ મોટો વધારો થતો રહેવો જોઈએ; પરંતુ આવું બનતું નથી. દા.ત., ૨૦૦૫-૦૬ના વર્ષમાં અનાજનો ભાવાંક ચાર ટકાથી ઓછો વધ્યો હતો. એનાથીયે પાછળ જઈએ તો ૧૯૯૯-૨૦૦૦થી ૨૦૦૩-૦૪નાં પાંચ વર્ષ દરમિયાન અનાજનો ભાવાંક લગભગ સ્થિર રહેવા પામ્યો હતો. જો વેપારીઓ સંઘરાખોરી કરીને અનાજના ભાવો વધારી શકતા હોય તો અનાજના ભાવો લગભગ સ્થિર શા માટે રહે ? આ જ દલીલ વાયદાના વેપારને લાગુ પડે છે. વળી, તાજેતરમાં થયેલા દુંગળીના ભાવોનો અપૂર્વ વધારો એ દર્શાવે છે કે જેમાં વાયદાનો વેપાર ન થતો હોય એવી ચીજોના ભાવોમાં પણ મોટો વધારો થતો હોય છે.

આમ છતાં, સંઘરાખોરી અને વાયદાના વેપાર અંગેની લોકપ્રિય દલીલમાં એક તથ્ય છે. જો ભવિષ્યમાં કોઈ વસ્તુના ભાવમાં મોટો વધારો થવાની શક્યતા સર્જય તો તેનો લાભ લેવા માટે વેપારીઓ હાજર બજારમાં તેમજ વાયદાના બજારમાં એ વસ્તુની મોટા પાયા પર ખરીદી કરે છે અને તેથી ભાવો વધે છે. એનાં બે પરિણામ આવે છે. એક,
વિશ્વવિહાર  **કન્ફરન્સ** 2019

આજની વાત

ભવિષ્યમાં થનાર અપેક્ષિત ભાવવધારો વર્તમાનમાં જ શરૂ થાય છે અને બીજું, ‘હજ્ઞયે ભાવો વધશે’ એવી ધારણા દૃઢ બનવાથી સંઘરાખોરી વધે છે અને પરિણામે ભાવો સવિશેષ વધે છે; પરંતુ આમાં પાયાની બાબત એ છે કે ભવિષ્યમાં ભાવો વધશે એવી અપેક્ષા બંધાવા માટે સબળ કારણ હોવું જોઈએ. ભવિષ્યમાં ભાવો વધવા માટેનું કારણ મોજૂદ ન હોય તો કેવળ સંઘરાખોરી કે વાયદાના વેપાર દ્વારા વેપારીઓ પોતાની ઇચ્છા પ્રમાણે અન્ય ચીજોના ભાવ વધારી શકે નહિ.

તાજેતરમાં કુંગળીના ભાવવધારાના સંદર્ભમાં એક મુદ્દા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. શાકભાજના જે ભાવો ખેડૂતોને મળે છે અને ગ્રાહકો તેના જે ભાવો ચૂકવે છે તેની વચ્ચે ઘણો મોટો તફાવત રહે છે. એક હડીકટ તરીકે આ સાચું છે. આના મૂળમાં ખેતપેદાશો માટેના બજારની બિનકાર્યક્ષમતા રહેલી છે. એ માટે વિવિધ કારણો જવાબદાર છે અને તે નિવારવા માટે મોટું મૂડીરોકાણ કરવું પડે તેમ છે; પરંતુ આ એક લાંબા ગાળાના વિકાસનો પ્રશ્ન છે. મુદ્દો એ છે કે બજારની આ બિનકાર્યક્ષમતા ખેતપેદાશોના ભાવમાં થતી મોટી વધઘટ માટે જવાબદાર નથી. દા.ત., કુંગળીના ભાવમાં જે મોટો વધારો થયો તે બજારની બિનકાર્યક્ષમતાનું પરિણામ નથી, પરંતુ કુંગળીના ઉત્પાદનમાં થયેલા ઘટાડાનું પરિણામ છે.

દેશમાં બે વર્ષથી ચાલી રહેલા અનાજના કુગાવાની શાસ્ત્રીય સ્વરૂપની સમજૂતી મતભેદનો વિષય બની છે. એક મત પ્રમાણે દેશમાં રાષ્ટ્રીય ઉત્પાદન(GDP)માં આઈ ટકાથી અધિક એવા ઊંચા દરે વધારો થઈ રહ્યો છે તેનું આ પરિણામ છે. આને કારણો લોકોના આવકખર્યમાં ઊંચા દરે વધારો થઈ રહ્યો છે અને તેથી ભાવો વધી રહ્યા છે. કેટલાક અર્થશાસ્ત્રીઓ આ મત સ્વીકારતા નથી. તેમની દલીલ પ્રમાણે ભાવવધારો મુખ્યત્વે આહારની ચીજોમાં કેન્દ્રિત થયેલો છે અને અન્ય ચીજોના ભાવો પ્રમાણમાં ઓછા વધે છે. વળી, અર્થતંત્રનો વૃદ્ધિદર વધુ પડતો ઊંચો હોય તો તેની જે તાજી અર્થતંત્રમાં વરતાવી જોઈએ તે જોવા મળતી નથી.

બીજી સમજૂતી પ્રમાણે ત્રણ વર્ષ પૂર્વની મંદીમાંથી અર્થતંત્રને ઉગારવા માટે સરકારે જે ઉત્જનાત્મક પગલાં ભરીને અર્થતંત્રમાં બર્યાવૃદ્ધિને પ્રોત્સાહન આપ્યું તેનું આ પરિણામ છે. શાસ્ત્રીય પરિભાષામાં કહીએ તો છેલ્લાં ત્રણેક વર્ષોથી અંદાજપત્ર પરની રાજકોશીય ખાધ ઊંચી સપાટી પર રહેવા પામી છે તેનું આ પરિણામ છે. દેશમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો તેમના અંદાજપત્ર પરની ખાધ ઘટાડે તે એનો ઉપાય છે.

દેશમાં ચાલી રહેલા કુગાવાને ડામવાની બાબતમાં સરકારે એક કપરી પસંદગી કરવાની છે : જો તે કુગાવાને ડામવા માટે વ્યાજના દરમાં મોટો વધારો કરે તો ભાવવધારાને ડામી શકાય. પણ રાષ્ટ્રીય ઉત્પાદનનો વૃદ્ધિદર ઘટી જાય અને રોજગારીની તકો ઓછી સર્જાય. બીજું બાજુ, સરકાર જે રાષ્ટ્રીય ઉત્પાદનના વૃદ્ધિદરને ઊંચી સપાટી (અનુસેંધન સોણમા પાને)

ଓર્જા વિશે મહત્વનું પ્રકાશન

ગુજરાતી વિશ્વકોશ, બાળવિશ્વકોશ અને એવાં અન્ય કોશો તૈયાર કરવા ઉપરાંત ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ અની ગ્રંથ-શ્રેણી દ્વારા જુદા જુદા વિષયના તજ્જ્ઞો પાસે ગ્રંથો લખાવીને પ્રગટ કરે છે. માત્ર પરિચયાત્મક નહીં પરંતુ એ વિષયે વિશે અભ્યાસપૂર્ણ વિસ્તૃત સામગ્રી આપવા ઉપરાંત એ વિષયના અધતન પ્રવાહની જાણકારી આપવામાં આવે છે. વિશ્વકોશના શુભેચ્છક શ્રી પ્રવીણચંદ્ર ગંભીરચંદ્ર શાહના સહયોગથી ચાલતી ગ્રંથશ્રેણીમાં અત્યારસુધી તેર પુસ્તકો પ્રકાશિત થયા છે અને જુદી જુદી શ્રેણીમાં કુલ ૪૩ પુસ્તકો પ્રગટ થયા છે.

આ ગ્રંથશ્રેણીમાં ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના ભૌતિકશાસ્ત્રના તજ્જ્ઞ અને પરામર્શક શ્રી પ્રહ્લાદ છ. પટેલનું 'ଓર્જા' પુસ્તક (કિંમત : એકસો રૂપિયા) પ્રકાશિત થયું છે. આપણે જાણીએ છીએ કે બ્રહ્માંડ ઓર્જાથી પ્રચુર છે. હવે તેની ઓર્જાનાં વિવિધ સ્વરૂપોની જાણકારી પ્રાપ્ય છે. તેને વપરાશ્યોગ-વ્યવહારુ બનાવવા જરૂરી રૂપાંતરણો અનિવાર્ય છે. ઓર્જાનાં આવાં રૂપાંતરણોને તેનું ઉત્પાદન ગણી શકાય. ઓર્જાનાં ઉત્પાદન અને ઉપયોગો અંતર્ગત કેટલીક સમસ્યાઓ સામે આવે છે. તેનાથી માનવ અને પૃથ્વી-ગ્રહના સ્વાસ્થ્ય (પર્યાવરણ) ઉપર વિપરીત અસરો ધ્યાનમાં આવી છે. આ પુસ્તકના આરંભે આવી સમસ્યાઓની ચર્ચા કરવામાં આવી છે અને તેનો ઉકેલ અહીં-તહીં આપવાનો પ્રયાસ કર્યો છે.

અહીં બે પ્રકારની ઓર્જાઓ – પરંપરાગત (conventional) ઓર્જા અને પુનઃપ્રાપ્ય (renewable) ઓર્જાની વિગતે વાત કરવામાં આવી છે. પરંપરાગત ઓર્જામાં જીવાશ્મી ઈંધણો (fossil fuels) – જેવાં કે કુદરતી વાયુ, તેલ, કોલસો અને અન્ય બનિજોમાંથી ઉપલબ્ધ થાય છે. આવાં જીવાશ્મી ઈંધણો સામે બે સમસ્યાઓની ચર્ચા કરેલી છે. એક તો, પૃથ્વીના પેટાળમાં તેનો જથ્થો મર્યાદિત છે અને ઝડપથી ઓસરતો જાય છે તે. એક જાડા અંદાજ પ્રમાણો તે જથ્થો સિસ્ટેર-એંશી વર્ષમાં ખલાસ થાય તેમ છે. બીજું, આ ઈંધણોના ઉપયોગથી કાર્બન ડાયોક્સાઇડ (CO_2) અને અન્ય ગ્રીનહાઉસ વાયુઓ વાતાવરણને પ્રદૂષિત કરે છે. આવી અશુદ્ધ ઓર્જાથી પર્યાવરણ-ભંગ થતાં પ્રકૃતિ સામે જોખમો ઉભાં થવા લાગ્યાં છે.

ન્યૂક્લિયર ઓર્જાનું ઉત્પાદન ઘણું ઓછું છે અને તેનું રાજકારણ મોટું છે. આ ઓર્જા શુદ્ધ ખરી પણ તેના ઉત્પાદન અને તેના કચરાના નિકાલના પ્રશ્નો ગંભીર અને ચિંતાનજક છે. તેની વિગતે વાત કરવામાં આવી છે.

જળવિદ્યુત ઓર્જાનો શુદ્ધ સ્થોત છે. પણ તે તો જ્યાં બંધ અને મોટાં જળાશયો હોય
વિશ્વવિહાર 3 ફેબ્રુઆરી ૨૦૧૧

નવું વાચન

ત્યાં જ શક્ય છે. દેશની નદીઓના આંતર-જોડાણથી સિંચાઈ ઉપરાંત જળવિઘૃત પેઢા કરવાનો એક અંદાજ છે, તેનો વિચાર રજૂ કરવામાં આવ્યો છે.

નવી ટેકનોલોજી આધારિત ઊર્જાના ઉત્પાદનને ત્રીજો પ્રકાર ગણાવી શકાય. જેમ કે ભરતીજન્ય ઊર્જા, સમુદ્ર-�ર્જા, ભૂતાપીય ઊર્જા, ચુંબકીય દ્વાગતિકીય ઊર્જા. આ બધી ઊર્જાનું પ્રમાણ ઓછું પણ અનુકૂળતાઓના આધારે તેમને સુલભ બનાવી શકાય તેમ છે. નવી ટેકનોલોજી-આધારિત ઊર્જા-ઉત્પાદનના માર્ગો હવે સુગમ બનતા જાય છે. તેનું વર્ષાન ઠીક ઠીક પ્રમાણમાં આ પુસ્તકમાં જોવા મળે છે. તેમાં ખાસ તો ગેંસ-હાઇડ્રોટ્સ અને કોલબેડ મિથેન, જીવભાર (biomass) ઊર્જા, ફ્યુએલ સેલ, બાયોફ્યુએલ્સ નવા આશાસ્પદ ઊર્જાના સોત છે. હવે તો આર્થિક અને રાજકીય કારણોસર હાઇડ્રોજન-�ર્જા વિશે ગંભીરતાથી વિચારણાઓ ચાલી રહી છે, કારણ કે આવા સોત વિપુલ છે.

�ર્જાનો ધ્યાનાકર્ષક પ્રકાર પુનઃપ્રાય ઊર્જા છે. તે પવન, પાણી અને પ્રકાશ(સૌર)માંથી મેળવાય છે. ઊર્જાનો આ સોત શુદ્ધ, અખૂટ અને અવિરત છે. આ પુસ્તકમાં તેની વિગતે સચિત્ર રજૂઆત કરવામાં આવી છે. પર્યાવરણની સુરક્ષા માટે આજે વિશ્વભરમાં પુનઃપ્રાય ઊર્જા માટે સંશોધનાત્મક પ્રયોગો અને ઉત્પાદન પુરજોશમાં ચાલે છે. પ્રકૃતિમાં આ અમૂલ્ય સ્થોત્રમાંથી ઊર્જાને કામમાં લેવા માટે અધતન (state of art) ટેકનોલોજી વિકસાવવામાં આવી રહી છે. આ રીતે પુનઃપ્રાય ઊર્જા પરંપરાગત ઊર્જાનો સારો અને વિધાયક વિકલ્ય સિદ્ધ થતો જાય છે.

�ર્જાના ઉત્પાદન બાબતે વિશ્વનું અને ભારતનું પરિદ્ધશ્ય રસપ્રદ અને લગભગ સર્વસમાવિષ્ટ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

�ર્જાના ઉત્પાદન અને ઉપયોગમાં વૈજ્ઞાનિક દિઝિકોણ અનિવાર્ય બનતો જાય છે. સામાજિક અને આર્થિક સમાનતા માટે ઊર્જાનું વિતરણ પ્રમાણસર અને બુદ્ધિગમ્ય હોવું આવશ્યક છે. આજે આ ક્ષેત્રે અસમાનતા હકીકિત છે અને સમાનતા એક મૂલ્ય છે, તે સમજવું રહ્યું, અલ્યવર્ગ દ્વારા ઊર્જાના બેફામ ઉપયોગ ઉપર, જરૂર પડે તો, કાનૂની નિયંત્રણ પડ્યા લાવવું પડે. લોકોની વૈભવી જીવનરૂપીથી થતી પ્રકૃતિની લુંટ અટકાવવી પડશે. ઊર્જા સંદર્ભ સમાનતા અને સભાનતાનાં નવાં પરિમાણોને બુદ્ધિગમ્ય માનવીય બનાવવાનો સવિસ્તાર પ્રયાસ કર્યો છે. મહત્વની માહિતીઓ આપીને વાચકને વિચારભાયું બંધાવ્યું છે. પુનઃપ્રાય ઊર્જાનાં મહત્વ અને અનિવાર્યતા માટે કહેવું પડે કે

"An invasion of armies can be resisted,

but not an idea whose time has come."

- વિકટર બુગો

આંતરરાષ્ટ્રીય રસાયણ વર્ષ ૨૦૧૧ (IYC-૨૦૧૧)

‘નામ શું તારું?’

કુમારી શીકોરૂસ્કાની ખાનગી કન્યાશાળાના એક વર્ગમાં દાખલ થતા અધિકારીએ પૂછ્યું.

‘મેરયા મેરયા સ્ક્લોરોસ્કા.’ બાળકીએ શાંતિથી જવાબ આપ્યો.

‘મેરયા ! વાહ ! નામ તો સરસ છે. બુદ્ધિશાળી પણ લાગે છે’ પ્રશંસા કરીને અધિકારીએ પૂછ્યું, ‘અચ્છા, એ બતાવ કે હમજાં કલાસમાં શું ભાગવવામાં આવતું હતું?’


ઘટના ઓગણીસમી સદીના આઠમા દસકાની છે. તે સમયે પોલેન્ડ દેશ આજાદ ન હતો. તેના વિભિન્ન ભાગો પર ત્રણ અલગ અલગ રાખ્યો કર્યો હતો. પોલેન્ડના પ્રભ્યાત શહેર વોર્સો પર રશિયાના હક્કેમ જારનું શાસન હતું. સ્થાનીય ભાષા બોલવી, ત્યાંનો ઇતિહાસ શીખવવો કે શિખવાડવો ગુનો બનતો હતો. શિક્ષકો છૂપી રીતે છાત્રોમાં દેશ-પ્રેમની ભાવનાનું રોપણ કરતા હતા. અને એટલે જ જાર સરકારના અધિકારીએ વિદ્યાલયોમાં અચાનક નિરીક્ષણ કરીને કોઈ શાળા આ નિયમોનો ભંગ તો નથી કરતી તેનું ધ્યાન રાખતા હતા. આવા અધિકારીના આગમન ટાણે ખાનગી શાળાઓમાં છૂપે સ્થાને ગોઠવેલી ધંટડી મંદ અવાજે જરા જુદી રીતે વાગતી હતી. આવો સંકેત મળતાં જ, વર્ગશિક્ષકો અને બાળકો સાવધાન રહ્ય જતાં.

સરકારી અધિકારીએ કરેલી પ્રશંસા ઓટી ન હતી. કલાસમાં સહૃથી નાની મેરયાને બધું જ આવડતું હતું. રશિયન ભાષા પણ તે સફાઈથી બોલી શકતી હતી. એટલે સરકારી છન્સ્પેક્ટરોના સવાલોના જવાબ આપવાનું મોટે ભાગે અને જ ભાગે આવતું હતું. આ વાત તે પોતે જાણતી હતી. અને એમ જ થયું.

તેમ છતાંય પુછાયેલા સવાલથી બધાના શાસ અધ્યર થયા.

નાની છોકરીએ બહુ સહજતાથી કહ્યું : ‘સર, કલાસમાં જારના સ્વાગતનું ગીત શીખવવામાં આવતું હતું.’

પછી અધિકારીના કહેવાથી મેરયાએ ‘આપણા પિતા’ની પ્રાર્થના શુદ્ધ સ્વરૂપે ગાઈ બતાવી. તેના અવાજમાં નહોતી ઊર્ભિ, નહોતો ભાવ. પોલિશ બાળકોને એમના કેંથલિક ધર્મની પ્રાર્થના હંમેશાં રશિયન ભાષામાં કરાવીને



IYC-૨૦૧૧ લોગો

વિશ્વવિહાર 5 ફેબ્રુઆરી ૨૦૧૧

વર્તમાન

તેમને માનભંગ કરવાની સૂક્ષ્મ કળા જાર સરકારે શોધી કાઢી હતી. તે પછી રશિયાના રાજ્યોઓ વગેરેને લગતા કેટલાક વાહિયાત સવાલોના જવાબ પણ તેણે બરાબર આપ્યા. ઇન્સ્પેક્ટરે વિચાર્યુ કે આ બાળની સ્મૃતિ સરસ હતી. અને કેવી અજબ ઉચ્ચારશુદ્ધ ! જાણે સેન્ટ પીટર્સબર્ગમાં જ જન્મી હોય !

બેલ બતમ થયો. અમલદાર માથું હલાવી બીજા ખંડ તરફ વળ્યો. વર્ગ-શિક્ષિકા તુપ્સાએ સંતોષનો દમ ભર્યો અને મેરયા તરફ જોઈ બોવી : ‘આવ બેટા, મારી પાસે આવ.’

મેરયા શિક્ષિકા પાસે ગઈ. શબ્દ પણ બોલ્યા. વિના તેણે તેના કપાળ પર ચૂમી કરી. અને એકાઓક જાગ્રત થતા જતા વર્ગમાં આ પોલિશ બાલિકા અત્યાર સુધી ખાળી રાખેલા ધિક્કાર સાથે જોરથી રડી પડી.

પછી તો મેરયાએ હાઇસ્ક્યુલની પરીક્ષામાં સમગ્ર પ્રાંતમાં અવ્યલ સ્થાન પ્રાપ્ત કર્યું. પણ તે માટે યોજવામાં આવેલા ઇનામવિતરણના સમારોહમાં તે ન ગઈ. કારણ કે તે રશિયન અધિકારીને હસ્તે આપવામાં આવતું હતું.

યહુદી જેવી તે કાળે હડ્ધૂત જાતિમાં તેનો જન્મ. કુટુંબમાં સૌથી નાની અને માબાપની લાડકી, સ્વદેશભક્ત આ બાળકી મોટી થઈને ફાંસના ભૌતિકશાસ્ત્રી પિયર્ટ ક્યૂરી (૧૮૫૮-૧૮૮૦) સાથે લગ્નથી જોડાવાની હતી અને મેડમ ક્યૂરી (માદામ ક્યૂરી) કે પછી મેરી ક્યૂરી (૧૮૬૭-૧૮૮૪) તરીકે મશહૂર થવાની હતી. તેની જીવનકથા અહીં માંડવી નથી. કારણ કે તેની નાની દીકરી ઈવ ક્યૂરી (૧૮૦૪-૨૦૦૭)એ આ કામ સુપેરે કર્યું છે. ૧૮૮૭માં અનેક દેશોમાં એકસાથે આ પુસ્તક પ્રસિદ્ધ થયું હતું. ૧૮૮૭માં તેના ઉપરથી હોલીવુડના એમ.જી.એમ. પ્રોડક્શને ફિલ્મ પણ બનાવેલી. આ પુસ્તકનો ગુજરાતી અનુવાદ ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રીશ્રી બલવંતરાય મહેતાએ ‘વિજ્ઞાનયોગિની માદામ ક્યૂરી’ નામે કરેલો, જે ૧૮૬૦માં નવજીવન સંસ્થાએ પ્રસિદ્ધ કર્યો હતો. ઈવ ક્યૂરીના આ પુસ્તકનો કેટલાક વિવેચકોએ વિરોધ કરેલો. તેમનું કહેવું એ હતું કે જીવનચરિત્રમાં પોતાની કેટલીક અણગમતી અંગત હકીકતો લખવાનું જાણી જોઈને ટાળવામાં આવ્યું છે. વાત સાચી પણ હતી, પરંતુ આપણે તે વિવાદમાં પડવું નથી. (મેડમ ક્યૂરીના જીવનચરિત્ર આવેખતાં અન્ય પુસ્તકો પણ ગુજરાતીમાં છે, જે પેકી આપણા પ્રખ્યાત વિજ્ઞાનલેખક અને રસાયનશાસ્ત્રી ડૉ. એન. એમ. શાહનું ૧૮૪૭માં પ્રસિદ્ધ થયેલું જીવનચરિત્ર ઉલ્લેખનીય છે. તે પછી ઘણાં વર્ષો બાદ, ડૉ. ઉપા જોશીએ પણ બાળકો માટે મેડમ ક્યૂરીનું જીવનચરિત્ર લખ્યું છે. બંને પુસ્તકોના પ્રકાશક છે ગુર્જર ગ્રંથરતન કાર્યાલય.)

આજે બહુ વપરાતો radioactivity શબ્દ મેડમ ક્યૂરીએ સૂચવેલો છે. ૧૮૮૮માં તેણે બે નવાં રેડિયોસક્રિય તત્ત્વોની શોધ કરી : પોલોનિયમ અને રેડિયમ. આવાં તત્ત્વોમાં સતત વિઘટનની પ્રક્રિયા ચાલતી હોય છે. આ પોલોનિયમ નામની પસંદગીમાં મેરીની ઉત્કટ દેશભક્તિ છલકે છે. રેડિયમ તત્ત્વની શોધ કરીને તેણે નાભિકીય ભૌતિકશાસ્ત્ર અને કેન્સરની તદ્દન નવતર ચિકિત્સાનો માર્ગ ખોલી આપ્યો. રેડિયોસક્રિયતા અંગે સંશોધન કરવા બદલ ૧૯૦૩નું ભૌતિકશાસ્ત્રનું પારિતોષિક મેડમ ક્યૂરી, તેના પતિ પિયર ક્યૂરી અને હેનરી બેંકેરલ (૧૮૫૨-૧૯૦૮)ને આપવામાં આવ્યું. નોભેલ પારિતોષિક મેળવનાર તે પહેલી મહિલા હતી. ૧૯૦૬માં પોરિસમાં રોડને કોસ કરવા જતાં અક્સમાતમાં તેના પતિનું અવસાન થયું. તે પછી સંશોધનમાં રત મેડમ ક્યૂરીએ રેડિયમ અને તેના ઘટકોની શોધ કરી એટલું જ નહીં, તેમને અલગ તારવવાની વિધિની પણ શોધ કરી. આ શોધો કરવા બદલ ૧૯૧૧માં તેને રસાયણશાસ્ત્ર વિષયનું નોભેલ પારિતોષિક આપવામાં આવ્યું. બે વખત આવું સંમાન મેળવનાર તે પહેલી વ્યક્તિ હતી. મેડમ ક્યૂરી પહેલી નોભેલ પારિતોષિક-વિજેતા મા હતી, જેની દીકરી ઈરીન અને જમાઈ ફેદરિક જોલિયો-ક્યૂરી બંનેને પણ ૧૯૩૮માં રસાયણશાસ્ત્રમાં નોભેલ પારિતોષિક મળ્યું. એક જ કુટુંબમાં ચાર નોભેલ પારિતોષિક !



મેરી ક્યૂરી (૧૮૬૭-૧૯૩૪)

ક્યૂરી દંપતી પોતાના આદર્શાને એટલી હંદે વરેલું હતું કે અનેક વિટંબાળાઓ વચ્ચે પણ પોતાની શોધોના પેટન્ટ ન લીધા. તે કાળે રેડિયમ દુનિયાની સહૃદી મૌંઠી ધાતુ હતી – પ્રતિ ગ્રામે એક લાખ પચાસ હજાર ડોલર ! આ ધાતુને અલગ તારવવાની વિધિના પેટન્ટ મેળવીને રાતોરાત તે અઢળક સંપત્તિના માલિક બની શક્યા હોત ! પરંતુ આવાં પ્રલોભનો તેમને ચણાવી ન શક્યાં. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન મેરીએ ક્ષક્રિયાઓ(એક્સ-રે) વડે ફોટા પાડવાની વિવિધ પદ્ધતિ વિકસાવી અને ધાયલ સૈનિકોને મદદ કરી. આજે જેને આપડો પોર્ટબલ-સર્વિસ કહીએ છીએ તેવી એક્સ-રેથી સર્જણ મોટર-કારો લઈને યુદ્ધમેદાનમાં ધૂમી વળી. મેરી અને આઇન્સ્ટાઇન વચ્ચે કૌટુંબિક મૈત્રીક સંબંધો હતા. તેના વિશે આઇન્સ્ટાઇન કહ્યું હતું : ‘સધણી વિખ્યાત વ્યક્તિઓમાં કીર્તિએ જેને કલુષિત ન કરી હોય એવી વ્યક્તિ મેરી ક્યૂરી એક જ છે.’

વर्तमान

૧૯૭૧માં મેરી ક્યૂરીને રસાયણશાસ્ત્રમાં શોધ કરવા બદલ નોબેલ પારિતોષિક મળ્યું. તે જ વર્ષ, પેરિસમાં 'International Association of Chemical Societies'ની સ્થાપના પણ થઈ. પાછળથી તેનું નામ બદલીને 'The International Union of Pure and Applied Chemistry' (IUPAC) કરવામાં આવ્યું. રસાયણવિજ્ઞાનમાં આ બંને ઘટના સીમાચિહ્નન ગણાય છે. આ બંને ઘટનાને ૨૦૧૧માં ૧૦૦ વર્ષ પૂરાં થયાં. તેના માનમાં આ વર્ષને 'અંતરરાષ્ટ્રીય રસાયણ વિજ્ઞાન વર્ષ' (International Year of Chemistry, સંકેપમાં : IYC-૨૦૧૧) તરીકે મનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. તેના કેન્દ્રનો વિષય (focal theme) છે : 'રસાયણ – આપણું જીવન, આપણું ભવિષ્ય' (Chemistry - Our Life, Our Future). આ પ્રસંગે સમગ્ર વર્ષ દરમિયાન બધા દેશોમાં રસાયણવિજ્ઞાન સંબંધિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણી મહિલા વૈજ્ઞાનિકોની સિદ્ધિઓને કેન્દ્રિત કરવાનો પણ અવસર પ્રદાન કરશે, કારણ કે મેરી ક્યૂરીની સિદ્ધિઓ અને તેમનું જીવન વિદ્યાર્થીઓને, ખાસ કરીને વિદ્યાર્થીઓને વિજ્ઞાનમાં કારકિર્દી પસંદ કરવા પ્રેરિત કરે છે. (અંતરરાષ્ટ્રીય સત્ત્રે આવી રીતે અમૃક વર્ષને વિશિષ્ટ રીતે ઊજવવાનો શિરસ્તો છેલ્લાં કેટલાંક વર્ષોથી આરંભાયો છે. જેમ કે, ૨૦૦૫ને ભૌતિકશાસ્ત્ર વર્ષ, ૨૦૦૮ને પૃથ્વી વર્ષ, ૨૦૦૯ને ખગોળ વર્ષ, ૨૦૧૦ને જૈવવિવિધતા વર્ષ તરીકે ઊજવવામાં આવેલાં.)

ભારતમાં અન્ય કાર્યક્રમો સાથે આચાર્ય પ્રકુલયંક્ર રાય (૧૮૬૧-૧૯૪૪) ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી શકે. રાયે મહત્વની શોધ કરવા ઉપરાંત, 'હિંદુ રસાયણશાસ્ત્રનો ઇતિહાસ' બે ભાગમાં લાખ્યો છે. ૧૯૫૬માં પ્રિયરંજન રેએ તેનું નવું સંશોધિત સંકરણ પ્રકાશિત કર્યું હતું. આ ફુતિનો ગુજરાતી અનુવાદ તૈયાર કરી શકાય. આ અવસરે, ધરાંગાંડી થઈ ગયેલા પ્રો. ત્રિભુવનદાસ ગજજર (૧૮૬૩-૧૯૨૦) જેવા રસાયણવિદને ધ્યાનમાં રાખીને પણ આયોજન કરી શકીએ. તેમની વિસ્તૃત જીવનકથા ગુજરાતીમાં છે જ. ડૉ. અશ્વિન મા. ત્રિવેદી, પ્રો. સાકણંદ જે. શાહ અને ડૉ. રાણીકલાલ કે. શાહે આ કામ સરસ નહીં, ઉત્તમ રીતે કર્યું છે. વડોદરાના પ્રાચ્યવિદ્યા મંદિર, મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયે ૧૯૮૮માં તેનું પ્રકાશન કર્યું હતું અને ૧૯૭૦માં તેનું પુનઃ મુદ્રણ થયું હતું. હાલમાં તે ઉપલબ્ધ નથી. કમસે કમ તેને નવી પેઢી માટે ઉપલબ્ધ કરાવી શકીએ. આ પ્રસંગે ઈ. સ. દાસની આસપાસ થઈ ગયેલા નાગાર્જુન જેવા આપણા પ્રાચીન રસાયણવિદને પણ યાદ કરી શકીએ. એવું માનવામાં આવે છે કે નાગાર્જુન ગુજરાતમાં સોમનાથની પાસે આવેલા દૈહક સ્થાનના નિવાસી હતા. ગુજરાતમાં થઈ ગયેલા નામી આધુનિક રસાયણવિદોની યાદી બનાવીએ તો પણ સહેજે ૨૦ તો તરત ૪ નીકળી આવે. તેમને યાદ કરવાનો આ સુઅવસર છે.

– ડૉ. સુશ્રુત પટેલ

હાસ્ય વિશે ગંભીર વાતો

આત્મવરણીવિર્ધેયાત્મા પ્રસાદમધિગચ્છતિ ॥ (2:64)

પ્રસન્નચેતસોદ્ધારા બુદ્ધિ: પર્યવતિષ્ઠતે ॥ (2:65)

શ્રીમદ્ ભગવદ્ગીતામાં ભગવાન કહે છે કે પોતાને વશમાં રાખતી ધ્યેયબદ્ધ વ્યક્તિ પ્રસન્નતા પામે છે. તેની બુદ્ધિ (પ્રકાશ) સ્થિર રહે છે. તેથી ૧૭મા અધ્યાયના ૧૬મા શ્લોકના પ્રારંભમાં જ મનનાં પાંચ તપોમાં પ્રથમ તપ મનની પ્રસન્નતા (મન:પ્રસાદ:) છે એવું જણાવાયું છે. પ્રસન્નતા પ્રાપ્ત કરવાની રીત, તેનું પરિણામ અને તેથી તેની પ્રાથમિકતા ધાર્મિક-આધ્યાત્મિક દૃષ્ટિએ મહત્વનાં છે.

સભરતા (પરિપૂર્ણતા), સંતોષ, પ્રેમ કે આનંદની લાગડી અથવા માનસિકતાને પ્રસન્નતા કહે છે. તેનાં જૈવિક, મનોવૈજ્ઞાનિક, ધાર્મિક અને તત્ત્વજ્ઞાનીય પાસાં છે જેને અનુરૂપ તેનાં સોતમૂળો અને વ્યાખ્યાઓ નિર્ધારિત થેયેલાં છે. મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિપ્રેક્ષ્યમાં પ્રસન્નતા વ્યક્તિનો વાતાવરણજન્ય અનુભવ અને પ્રતિભાવ બંને છે. તેનું માપન કે તેને માટેનાં પરિમાણો નિશ્ચિત કરવા માટે કોઈ એકમ નિર્ધારિત કરાઈ શકતો નથી. પ્રસન્નતાલક્ષી અર્થશાસ્ત્રમાં જાહેર ખુશીને અન્ય અર્થશાસ્ત્રીય પરિમાણો સાથે જોડવામાં આવે છે.

જૈવિક પરિપ્રેક્ષ્યમાં પ્રસન્નતાને સમજવા માટે મગજમાંનાં ડોપામિન, અફીણાભ દ્રવ્યો (opiates) અને એન્ડોફિન્સ નામનાં રસાયણો સાથે સાંકળવામાં આવી છે. આ રસાયણો મગજમાં ચેતાતંતુઓ વચ્ચે સંદેશાની આપલે માટે સક્રિય હોય છે. તેમને ચેતાસંદેશવાહકો કહે છે. તેમની પ્રણાલીઓ જે તે ક્ષણો થતા ખુશી કે આનંદના અનુભવ સાથે સંકળાયેલી હોય છે. ક્યારેક તે બાબ્ય સંવેદનાઓ પર આધારિત હોય છે, જેમ કે મજાક સાંભળીને કે હાસ્યપ્રધાન નાટક જોતાં મજા પડી જાય. પ્રસન્નતાની સ્થાયી અથવા દીર્ઘકાળીન સ્થિતિનો અનુભવ વ્યક્તિના સંજોગો પર કે વ્યક્તિ પોતાના પર્યવરણમાં પોતાને કેવી સ્થિતિમાં અનુભવે છે તેના પર આધાર રાખે છે. આત્મગૌરવની અનુભૂતિ, વ્યક્તિગત કે સામાજિક લાભ, દ્યા અને કરુણા, મજાક-મસ્તી કે સૌંદર્યાનુભવ (aesthetic appreciation) વગેરે વિવિધ બાબતો પ્રસન્નતાની ભાવના સર્જ છે.

સન ૨૦૦૮માં બ્રિટિશ મેડિકલ જર્નલમાં સામાજિક સંપર્કજીળની પ્રસન્નતા કે બેદના ફેલાવા પર થની અસર સમજાવતો એક અભ્યાસ રજૂ થયો હતો. તેને 'ઇમ્પિગહામ હફ્ટયલક્ષી અભ્યાસ' કહે છે. તેમાં ૫૦૦૦ વ્યક્તિઓને ૨૦ વર્ષ સુધી નિરીક્ષણ હેઠળ રખાઈ હતી. તેમાં જોવા મળ્યું હતું કે નજીકનાં મિત્રો, ભાઈબહેનો, દંપતી અને શાખપાડોશીઓ વચ્ચે પ્રસન્નતા સરળતાથી પ્રસરે છે. વળી એ પણ જોવા મળ્યું હતું કે આટલી સરળતાથી બેદનો ફેલાવો થતો નથી. આવાં સામાજિક વર્તુળોમાં જે વ્યક્તિ

સંશોધન

કેન્દ્રસ્થાને હોય તેનામાં પ્રસન્નતાની તીવ્રતા વધુ રહે છે. આમ સામાજિક જૂથોમાં પ્રસન્નતા એક વિખાળુજ ચેપની જેમ ફેલાય છે અથવા સંક્રમણ કરે છે. યુવાનો કરતાં વૃદ્ધો વધુ પ્રસન્નતા અનુભવે છે અને તેઓમાં પ્રસન્નતાનો વધારો પણ ખૂબ રહે છે. યુવાનોમાં કોથ કે ગુસ્સો, અંજંપો કે આશંકા, બેદ કે જિન્નતા, આર્થિક સમસ્યાઓ, સંબંધોમાં ખારાશ અને વ્યાવસાયિક અસલામતી વધુ જોવા મળી હતી. એકલા હોઈએ તે કરતાં સમૂહમાં હોઈએ ત્યારે હાસ્ય અને આનંદ વધુ ઉત્પન્ન થાય છે. કોમેરી શોમાં હાસ્યની કે તાળીઓ પાડવાની પ્રક્રિયા કે તે અંગેની ઓડિયો ક્લિપ પોતે પ્રસન્નતાપ્રેરક બની રહે છે.

હાસ્ય : હાસ્ય વ્યક્તિની આંતરિક કે બાહ્ય ખુશી, મજાક, પ્રસન્નતા કે ઉતેજનાની અભિવ્યક્તિ છે. મજાક, ગલીપચી, હાસ્યાસ્પદ પરિસ્થિતિ વગેરેથી માંડીને આંતરિક નિજાનંદ હાસ્ય પ્રેરે છે. મોટા ભાગના કિસ્સામાં તે આનંદદાયક સંવેદના છે; પરંતુ ક્યારેક તે રૂદુન કે કરુણ પરિસ્થિતિનું આવરણ પણ બને છે. આમ તે એક રીતે સામાજિક વ્યવહારની બાબત છે. માશસ અને અન્ય કેટલાંક પ્રાણીઓ હસી શકે છે. હાસ્ય વ્યક્તિઓ વચ્ચેના વાદ-વિવાદ-સંવાદરૂપી પ્રત્યાયનમાં લાગણીનો ઉમેરો કરે છે.

હસવા માટે મગજમાં કોઈ ચોક્કસ ચેતાવિસ્તાર કે ચેતાકેન્દ્ર નથી. પ્રસન્નતા-(happiness)ના અનુભવમાં મગજનો અગ્રસ્થ ખંડ (frontal lobe) અને સમુદ્રાશ-વલિકા (hippocampus gyrus) નામની મગજના ભૂખરા રંગના વિસ્તારની ગડી સક્રિય હોય છે. અધશ્રેષ્ઠક (hypothalamus) નામનો ચેતાવિસ્તાર પણ લાગણીજન્ય મનોભાવનું નિયંત્રણ કરીને પ્રસન્નતાના અનુભવ સાથે જોડાય છે. મોટા મગજનો ભૂખરા રંગનો બાધકવિસ્તાર (cortex) પ્રસન્નતાની હાસ્ય કે સ્મૃતિના રૂપે થતી અભિવ્યક્તિમાં વધારો કે ઘટાડો કરે છે. આ બધા જ ચેતાવિસ્તારોમાં સંવેદનાની આપલે માટે ડોપામિન-સંલગ્ન દ્રવ્યો, અઝીણાભજૂથ(opiates)-સંલગ્ન દ્રવ્યો કે એન્ડોર્ફિન નામના ચેતાસંદેશવાહક દ્રવ્યો સક્રિય હોય છે. તેઓના કારણો આનંદ કે બેદ દર્શાવતી (હાસ્ય કે રૂદુન સંબંધિત ક્લિયાઓ) ચેતાકિયાઓ સંભવિત બને છે.

ગળામાં સ્વરપેટીના સ્વરચિદ્રને ઢાંકતો અધિસ્વરચિદ્રપટલ (epiglottis) નામનો પડદો આવેલો છે. તેના અને સ્વરપેટીના હલનચલનથી હાસ્યનો અવાજ ઉત્પન્ન થાય છે. જો મોટા અવાજે હસાય તો તેને અહૃહાસ્ય કરે છે. તેમાં શ્વસનતંત્રના અન્ય સ્નાયુઓ પણ કાર્ય કરીને ફેફસાંમાંથી વિપુલ જથ્થામાં હવા બહાર ફેંકે છે. હાસ્યની આ બાધ અભિવ્યક્તિના કારણરૂપ અંદરની આનંદની અનુભૂતિ પોતે પણ વિવિધ દેહધાર્મિક અને મનોવૈજ્ઞાનિક અસરો ઉત્પન્ન કરે છે. તેના અભ્યાસને હાસ્યવિદ્યા (gelotology) કહે છે. જો વ્યક્તિ હસી ન શકે તો તેવા વિકારને નિર્હાસ્યશીલતા (aphonogelia) કહે છે. તે ભાગે થતો ચેતાવિકાર છે. ક્યારેક વ્યક્તિ પોતાના તરફ ધ્યાન આકર્ષિત વિશ્વાસિર 209 10 ફેબ્રુઆરી 2019

સંશોધન

કરાવવાના મનોવિકાર રૂપે મોટેથી મનોવિકારી ધ્યાનાકર્ષિતાજ્ઞ્ય હાસ્ય (hysterical laugh અથવા gelasmus) કરે છે. ધનુર્વાનો રોગ કે ઝેરકચોલુની જેરી અસર થઈ હોય ત્યારે દર્દીના ચહેરા પર સ્નાયુઓના સતત સંકોચનને કારણે તે હસતો હોય તેવું લાગે છે. તે એક પ્રકારનું રોગચિહ્ન છે. તેને રોગદર્શી સ્મિત (risus sardonicus અથવા hipocratic smile) કહે છે.

સ્મિત : ખુશી, આનંદ કે મજા પડે તેવી સ્થિતિના અનુભવને વ્યક્ત કરતી ચહેરા પરની અભિવ્યક્તિને સ્મિત કહે છે, જેમાં મુખ્યત્વે મુખદ્વાર(હોઠ)ના બંને છેડાના સ્નાયુઓ સંકોચાય છે અને મોઢાની બંધ ફાડ લંબાય છે અને/અથવા સહેજ ખૂલી જાય છે. ક્યારેક ચિંતા, આશંકા કે ઉપહાસના સમયે પણ મૌની ફાટ સહેજ વાંકી થાય તે રીતે લંબાય છે. તેને મૌન મચકોડવું (grimace) અથવા કટાક્ષયુક્ત સ્મિત પણ કહે છે.

આમ સ્મિત અને હાસ્ય સામાજિક અભિવ્યક્તિ રૂપે આનંદ ઉપરાંત દુઃખ, ચિંતા, આશંકા, ઉપહાસ વગેરે અન્ય ભાવો પણ દર્શાવે છે. વિવિધ સંસ્કૃતિઓમાં તેમને અંગે વિવિધ પ્રકારના વ્યવહારો છે અને તેથી તેઓ કાં તો સ્વયંભૂ હોય કે કાં તો કૃત્રિમ હોય છે. મોઢાની ફાડ લંબાય કે તેનો છેડો ઉપર તરફ ખેંચાય તેની સાથે જો આંખ પણ જીણી થાય તો તેના પ્રથમ વર્ણવનાર વૈજ્ઞાનિકના નામથી ડ્યુશેન સ્મિત (Duchene smile) કહે છે. આવું આંખ સહિતનું સ્મિત એટલે કે ‘નેત્રોષ્ટસ્મિત’ અથવા ડ્યુશેન સ્મિત સામાન્ય રીતે સ્વયંભૂ અને સાચું હોય છે કેમ કે મોટા ભાગના માણસો આંખને જીણી કરતાં બાબ્ય પરિપલક સ્નાયુનું સંકોચન પોતાની ઇચ્છાથી કરી શકતા નથી. માત્ર હોઠોની વંકતા કે વકતા દર્શાવતું સ્મિત સાચું કે કૃત્રિમ હોઈ શકે પણ આંખો જીણી થાય તેવું સ્મિત મોટે ભાગે સાચું સ્મિત હોય છે. ક્યારેક સ્મિત વખતે હોઠોની વંકતા કરતા સ્નાયુના બે ભાગ હોય અને એક ભાગ હોઠની નીચે સુધી લંબાતો હોય તો તેના સંકોચનથી ગાલમાં ખાડો અથવા બંજન પડે છે. આવું બધી વ્યક્તિઓને થતું નથી. બંજન સ્મિત તથા ચહેરાને અદકેરું રૂપ આપે છે.

એક વર્તુળમાં કે ગોળા પર આંખ માટે ટપકાં અને મુખફાડ માટે વાંકી લીટી દર્શાવીને જે આકૃતિ કે ચિત્રાંકન તૈયાર કરાય તેને ‘સ્માઇલી (smiley)’ કહે છે અને તેને સ્મિતનું તાદ્દશચિહ્નન (symbol) કહે છે. તેને પેટન્ટ કરવામાં આવેલું છે.

સામાન્ય રીતે ૪ મહિનાનું બાળક હસી શકે છે; પરંતુ કેટલાક સંશોધકોએ તે ૧૭ દિવસના નવજાત શિશુમાં પણ દર્શાવ્યું છે. જન્માંધ અને જન્મબદિર બાળક પણ હસી શકે છે અને તે એક એવી અભિવ્યક્તિ છે જે બોલવાનું આવડે તે પહેલાંથી બાળક શીખી લે છે.

હાસ્ય અને આરોગ્ય : મેરિલેન્ડ મેડિકલ સેન્ટરે સન ૨૦૦૫માં હસવાથી લોહીની નસો પહોળી થાય છે અને તેથી હદ્દ્ય તથા અન્ય અવયવોમાં રુધિરાભિસરણ સુધરે વિશ્વિહાર ૧૧ ફેબ્રુઆરી ૨૦૧૧

સંશોધન

છે એવું એક અભ્યાસમાં દર્શાવ્યું હતું. હસવાના સમયે મગજના અધશ્રેતક (hypothalamus) વિસ્તારમાં બીટા-એન્ડોર્ફિન્સ પ્રકારનાં સંયોજનો (રસાયણો) વિમુક્ત થાય છે જે લોહી દ્વારા પરિભ્રમણ પામીને નસોને પહોળી કરે છે. આ ઉપરાંત નસોની અંદર દીવાલ-અંતશ્છેદ, endothelium-ના કોષોમાંથી નાઇટ્રિક ઓસિડ વિમુક્ત થાય છે જે સ્થાનિક સોજો અને લોહીના ગંઠનકોષો(platelets)નું એકત્રીકરણ ઘટાડે છે અને આમ તે રુધિરાભિસરણ સુધારે છે. આ ત્રણોય પ્રક્રિયાઓ હદ્યરોગના હુમલામાં થતા વિકારોથી વિપરીત છે અને તેથી તે હાસ્ય કદાચ વ્યક્તિને હદ્યરોગ, લક્વો વગેરે જેવા નસોના રોગોથી રક્ષણ આપે છે. તેને કારણે હાસ્યકલબો (laughing clubs) પણ અસ્તિત્વમાં આવી છે.

ગલીપચી કરાય તે સમયે ચામડીમાંના ચેતાતંતુઓમાંથી કેરોલિનિન નામનું એન્ડોર્ફિન વિમુક્ત થાય છે. તે હાસ્ય સર્જ છે. ક્યારેક વધુ પડતી ગલીપચી અસ્વીકાર્ય બને તો તે વિરોધ કે આકોશ સર્જ છે. નાનાં જંતુઓના ચાલવાથી થતી સંવેદના પણ ઘણી વખત અસ્વીકાર્ય રહે છે. તેથી ફક્ત સામાજિક રીતે સ્વીકાર્ય અને બિનહાનિકારક સંજોગોમાં ચામડીના સૌથી વધુ સંવેદનશીલ વિસ્તારોમાં કરાતી ગલીપચી હાસ્યપ્રેરક બની રહે છે. ગલીપચીથી ઉદ્ભવતી સંવેદનામાં આકસ્મિકતા અને અજાણપણું મહત્વનાં છે અને તેથી વ્યક્તિ પોતાને ગલીપચી કરીને આનંદ મેળવી શકતી નથી.

હાસ્યવાયુ (nitrous oxide) નામના વાયુના સંસર્જના આવવાથી અનિયંત્રિત રૂપે વ્યક્તિ હસ્યા કરે છે. તે એક સમયે દાંત પાડવા માટે બેભાન કરવા માટે વપરાતો ઔષધીય વાયુ હતો. હાલ તેના વિવિધ ઔદ્યોગિક ઉપયોગો છે. તેની હાસ્યપ્રેરકતાને કારણે ભૂતકાળમાં ‘હાસ્યવાયુ-મિજલસો’ અથવા laughing gas parties પણ યોજાતી. આ વાયુ તેની ચેતાતંત્ર પરની અસરને કારણે વ્યક્તિના વર્તન પરનો મગજનો કાબૂ ઘટાડે છે અને તેને સ્વર્ગસુખભાબસ (euphoria) કરાવીને સતત અને અમર્યાદ હસાવ્યા કરે છે.

વિવિધ ભેટ આપવાની વસ્તુઓની દુકાનમાં હસતી, જાડી, મોટી ફાંદવાળી, આડી પડીને કે અઢેલીને બેઠેલી વૃદ્ધ વ્યક્તિની કૃતૂહલપ્રેરક મૂર્તિ વેચાણ માટે મળતી સૌચે જોઈ છે. તેને હસતા બૃદ્ધ (laughing Buddha) કહે છે. તે ચીન તથા બૌદ્ધધર્માંમાં સ્વારસ્થ, સમૃદ્ધ અને સુખપ્રસન્નતા(nun)નું ચિહ્ન મનાય છે.

દરેક વર્ષના ઓંકટોબરના પ્રથમ શુક્રવારને ‘વિશ્વસ્મિતદિન’ તરીકે ઊજવવાનું ‘સ્માઈલી’ના સંશોધક હાર્વે બોલે ૧૯૮૮માં જ્ઞાયું હતું અને તેના મૃત્યુ (૨૦૦૧) પછી દર વર્ષ તે દિવસને વિશ્વસ્મિતદિન તરીકે ઊજવાય છે. આ વર્ષ(૨૦૧૦)નું તેમનું સૂત્ર હતું – ‘દ્યાનું એક કામ કરો, કોઈ એકને સ્મિત સર્જવામાં મદદ કરો.’ હાસ્ય અને સ્મિત ફક્ત પ્રસન્નતાને કારણે જ સર્જતાનાં નથી, તે પોતે પણ પ્રસન્નતા સર્જ છે.

– ડૉ. શિલીન નંદુભાઈ શુક્લ

બે પેઢી વર્ષ્યેનું અંતર : છાયાનિક અને ચથાર્થ

‘જનરેશન ગોપ’ એટલે શું ? : સામાન્ય રીતે ‘જનરેશન ગોપ’ના મુદ્દાને અમેરિકા તરફથી વધુ પ્રોત્સાહન મળ્યું છે. ત્યાં વક્તિ-સ્વાતંખ્યના અતિરેકે બે પેઢી વર્ષ્યેની નિકટતા સામે અનેક પ્રશ્નો સજ્યા છે.

‘જનરેશન ગોપ’ ક્યારે સર્જાય ? : વિવાદ માટે જીદ જોઈએ, સહમતી માટે બીજાનો દૃષ્ટિકોણ સમજવાનું ધૈર્ય – ભતલબ કે સમજવાની અને એમાંથી સત્ય તારવવા સંવાદ માટેની તૈયારી બાબતે બે વક્તિ અલગ-અલગ દૃષ્ટિકોણના દઠાગઠી બની ફંટાય, સંઘર્ષ કે વિદ્રોહ કરવા તૈયાર થાય ત્યારે એક પ્રકારની ‘તિરાડ’ સર્જાય છે. આવી તિરાડ ટૂંકા કે લાંબા સમય માટે બે વક્તિ કે બે પેઢી વર્ષ્યે ‘અંતર’ સર્જ છે, જેને ‘જનરેશન ગોપ’ તરીકે ઓળખવામાં આવે છે. વડીલો પોતાના વિચારોને ચુસ્તતાપૂર્વક પકડી રાખી પોતાના વિચારોનું સંતાનો પર આરોપણ કરવાનો પ્રયત્ન કરે ત્યારે બે પેઢી વર્ષ્યેના અંતરની માત્રા વધી જાય છે. વૃદ્ધો પાસે શ્રદ્ધા અને શંકા બંનેનો અતિરેક હોય છે, જ્યારે યૌવન પાસે પરંપરાઓ સામેની શંકા અને નવા ચીલે ચાલવાની વૃત્તિ હોય છે. વડીલો પોતાની કૂટપદ્ધી કે માપદંડથી યુવાપેઢીને માપે તે તેમને એટલે જ નથી ગમતું. યુવાનના શબ્દોમાં કહીએ તો : ‘મને જો કોઈ સમજ શક્યું હોય તો તે મારો દરજ છે, કારણ કે એણો હંમેશાં મારું માપ નવેસરથી લીધું છે.’ બે પેઢી વર્ષ્યે સર્જતા અંતરની દુઃખ પરિસ્થિતિનું નિરૂપણ કરતાં સ્વ. કવિ હરીન્દ્ર દવેએ કહ્યું છે :

‘બેચેન છે વસંત ને ઉદાસ પાનખર,

ડાળિનો કૂલ પરથી ભરોસો ઊઠી ગયો.’

આ ‘ભરોસો ઊઠી જવાની સ્થિતિ’ એટલે જ ‘જનરેશન ગોપ’.

સંગીતના એક જલસામાં પિતા અને પુત્ર બંને સંગીતકારો મંચ પર હાજર હતા. પુત્રને પિતાનો પરિચય આપવાની કામગીરી સોંપવામાં આવી. પુત્રે પિતાનો પરિચય આપતાં કહ્યું : ‘માનવંતા શ્રોતાઓ, હું જેમને પ્રેમ કરું છું, એ લોકો પૈકી જો કોઈને સૌથી ઓછો ઓળખતો હોઉં તો તે મારા પિતાજી છે.’ કદાચ આવો બળાપો કે વેદના પેલા સંગીતકારના પુત્રનાં અંગત નહીં પડા અનેક તરુણો-યુવાનોનાં હોઈ શકે !

વડીલ કે વૃદ્ધ પેઢીની શ્રદ્ધા અને યુવાપેઢીની તે શ્રદ્ધાને પ્રથમ તબક્કે શંકાની નજરે નિહાળવા સંદર્ભ હિન્દીના ઝ્યાતનામ કવિ હરવંશરાય બચ્યનની એક કવિતા વિચાર માણી લે તેવી છે.

હરિવંશરાય બચ્યનની એ કવિતાનો સારાંશ એવો છે કે તેઓ યુવાવયમાં પોતાના પિતાજી સાથે એક ગામથી બીજે ગામ ચાલતા જઈ રહ્યા હતા. રસ્તામાં લીમડાનાં બે ઝડ જોઈ અમના પિતાજીએ તે વૃક્ષોને વંદન કરવા હરિવંશરાયજીને જણાવ્યું અને તેનો

સંદર્ભ સમજાવતાં કહ્યું કે તુલસીદાસજી ‘રામચરિતમાનસ’ની રચના કરતા હતા, ત્યારે આ સ્થળોથી પસાર થતાં દાતાશ કરી તેની ચીરીઓ અહીં ફેંકી હતી અને ચમત્કારિક રીતે જ અહીં લીમડાનાં બે વૃક્ષો ઉણ્યાં. એટલે તુલસીદાસજી તરફના ભક્તિભાવ અને આદરની દૃષ્ટિએ આ વૃક્ષો નમનપાત્ર છે.

આવી જુનવાળી વાત હરિવંશરાયજીને પસંદ ન પડી. અને તે વૃક્ષોને નમન કરવાનું ટાજું !

ભાડી-ગાડી મોટા થયા બાદ તુલસી-સાહિત્યનો અભ્યાસ કરતાં તુલસીદાસજીની રચનાઓનો મર્મ અને ઉપયોગિતા તેઓ સમજી શક્યા. અને યૌવનમાં, પેલાં લીમડાનાં ઝાડને નમન નહીં કરવાની ભૂલ તેમને સમજાઈ. કવિ અંતમાં કહે છે કે હવે હું મારા બંને પુત્રો સાથે એ સ્થળે જઈશ, તેમને તુલસીદાસજીની સ્મૃતિરૂપ તે વૃક્ષોને નમન કરવાનું કહીશ અને તેઓ શંકાથી નમન કરવાનું ટાળશે, ત્યારે મને સંતોષ થશે કે ભૂતકાળમાં યુવાવયે કરેલી ભૂલનું પ્રાયશ્ચિત્ત મેં કર્યું છે.

દૃષ્ટિકોણાના ભદ્રને કારણે જુદી જુદી વય ધરાવતી બે વ્યક્તિઓ કેવી રીતે વિચારતી હોય તેનું એક દૃષ્ટાતા :

દાદાજી અને તેમનો નાનકડો પૌત્ર ફરવા નીકળે છે. આંબલીના ઝાડ નીચેથી પસાર થતાં દાદાજી કહે છે : ‘દીકરા, જોયું ? કુદરતમાં પ્રમાણભાન જેવી કોઈ વસ્તુ છે ? આટલું મોટું ઝાડ અને તેનું ફળ (કાતરો) આટલું નાનું ?’

આગળ વધતાં કોળાના વેલા પાસે બંને પહોંચે છે. દાદાજી નકારાત્મક અભિપ્રાય આપતાં કહે છે : ‘જોયું બેટા, કુદરત પાસે પ્રમાણભાન જેવી કશી સમજા છે ? આટલો પાતળો વેલો અને આટલું મોટું કોણું ?’

દાદા અને પૌત્ર પાછા ફરે છે. આંબલીના ઝાડ પાસેથી પસાર થાય છે. એટલામાં આંબલીનો એક નાનકડો કાતરો તૂટીને દાદાજીની ટાલમાં પડે છે ! પૌત્ર કહે છે : ‘દાદાજી, કુદરત કેવી ડાહી છે. આ આંબલીને કોળા જેવું મોટું ફળ કુદરતે આપ્યું હોત તો એ તૂટીને આપના મસ્તક પર પડતાં કેવી સ્થિતિ પેદા થાત ?’

સકારાત્મક અને નકારાત્મક દૃષ્ટિકોણ વચ્ચેનું આ છે અંતર !
‘સ્થાનાંગામાં ચાર પ્રકારના પુત્રો ગણાવવામાં આવ્યા છે. તેમ ચાર પ્રકારના પિતા પણ ગણાવી શકાય છે.

ચાર પ્રકારના પુત્રો

1. પિતા કરતાં સવાયા પુત્રો
2. પિતાને સમકક્ષ પુત્રો
3. પિતા કરતાં કમજોર પુત્રો
4. કુલાગાર એટલે કે ચારિશ્યાહીન

અથવા દુષ્ટ પુત્રો

ચાર પ્રકારના પિતા

1. દશરથમાર્ગી પિતા
2. ધૃતરાષ્ટ્રમાર્ગી પિતા
3. કંસમાર્ગી પિતા
4. હંસમાર્ગી પિતા

వక్తవ్య

અહીં યુવાનો તથા વૃક્ષોના મનોજગતના કેટલાક વિચારણીય મુદ્દા છે. જોકે એમાં દર્શાવેલી બધી જ બાબતો બધા જ યુવાનો કે બધા જ વૃક્ષોને લાગુ ન જ પડે.

યુવા માનસ

વૃદ્ધોનું માનસ

- આશા-ઉત્સાહ-ગતિ, સાહસ અને જિજ્ઞાસા, શક્તિનો પ્રચંડ ધોઘ.
 - નવીનતાની જંખના
 - રોક-ટોક પ્રત્યે અણગમો
 - ચીલે ચાલવાનો નહીં – નવો ચીલો પાડવાની તમના
 - અલગ ‘આઇડેન્ટિટી’ – આગવી ઓળખની અભીષ્ટા
 - ‘જોશ’ વધુ, હોશ ઓછો.
 - સંવેદનશીલતા, લાગડીશીલતા વધુ.
 - સ્વતંત્ર દિમાગ
 - આશાવાદિતા, સ્વભાવીલતા
 - * બે પેઢી વચ્ચેનું અંતર કેવી રીતે ઘટી શકે ?
 - બે પેઢી વચ્ચે સ્વસ્થ સંવાદ
 - વૃદ્ધ થોડા જવાન થવાની તૈયારી અને જવાને થોડા વૃદ્ધ (પરિપક્વ) થવાની તૈયારી.
 - વૃદ્ધોએ, વડીલ હોવાને કારણો સમયોચિત સહિષ્ણુતા, ઉદારતા, સમાધાનવૃત્તિ, સમાનુકૂલન અને ક્ષમાભાવ વિકસાવવાનો સ્વયંભૂ પ્રયત્ન.
 - અધિકારપ્રયત્નાને બદલે ત્યાગપ્રયત્ના
 - માતા-પિતા સંતાનોના ટ્રસ્ટી છે એ વાત યાદ રાખવી જોઈએ, માલિક નહીં.
 - સંતાનોમાં જવાબદારીની ભાવના વિકસે તે માટે તેમની સાથે નાનપણથી જ આત્મીયતાપૂર્ણ નાતો, ચારિત્રશીલ શિક્ષણની આવશ્યકતા.
 - ‘બાલમંદિરો’ જેટલાં જ ‘બાપમંદિરો’ની જરૂરિયાત. લૉડ રોચેસ્ટર કહે છે :

विश्वकोशवृत्त

જ્ઞાન-વિજ્ઞાન વ્યાખ્યાનશૈળી

❖ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની શ્રી ભદ્રકર વિદ્યાધીપક જ્ઞાન-વિજ્ઞાન વ્યાખ્યાનશૈક્ષણિના ઉપક્રમે ફેબ્રુઆરી મહિનામાં બે વ્યાખ્યાનો સાંજે પાંચ વાર્ષે શ્રી હીરાલાલ ભગવતી સભાગૃહમાં યોજવામાં આવ્યાં છે :

૧૬ ફેબ્રુઆરી, ૨૦૧૧, બુધવાર : વિષય : ફિલ્મકળા : સમાજ, સૌંદર્ય અને સત્તા
વક્તા : શ્રી પરેશ નાયક

૨૩ ફેબ્રુઆરી, ૨૦૧૧, બુધવાર : વિષય : ઓરિક ફોમના ‘આર્ટ ઓફ લિવિંગ’
પુસ્તક વિશે
વક્તા : શ્રી સરેશ પરીખ

ਖਿੰਚੁਕੋਂਥਾ ਅਖਿੰਚੁਕਲਾਕੇਂਦ

◆ ૧૨ માર્ચ, ૨૦૧૧, શનિવાર, સાંજે ૫-૩૦ વગ્યે :

કાવ્યસંગીતશ્રેણી અન્વયે શ્રી અમર ભણ સુન્દરમૂનાં ગીતો પ્રસ્તુત કરશે.

‘બાળઉછેરના સમયે મારી પાસે બાળઉછેરના છ સિદ્ધાંતો હતા. આજે મારી પાસે છ બાળકો છે અને સિદ્ધાંતોના નામે મીંડું.’

અહીં એ વાત યાદ રાખવી જોઈએ કે ‘જનરેશન ગોપ’ એ કોઈ આકસ્મિક ઘટના નથી; પરંતુ સંતાનના ઉછેરમાં મા-બાપે દાખવેલી ઉપેક્ષાની પાથડીનો વળ છે. પશ્ચિમની જીવનશૈલીના પ્રભાવને કારણે આજે બે પેઢી વચ્ચેના સંબંધોમાં ‘અંતર’ વધી રહ્યું છે ત્યારે ‘જનરેશન ગોપ’ માટે ‘જનરેટેડ ગોપ’ મહત્વનો ન બની જાય એની કાળજી રાખવી પડશે. આ ‘ગોપ’માં ક્યાંક કલ્પના છે, ક્યાંક વાસ્તવિકતા છે તો ક્યાંક બે પેઢીમાં પરસ્પરને સમજવાની, સહેવાની અને જદુને તિલાંજલિ આપી ‘હક’ને બદલે ફરજ અને નિસ્વાર્થ પ્રેમને મહત્વ આપવાની ભાવનાની ઊંઘાપ છે. આ પ્રશ્ન અશ્રદ્ધા, વિવાદ, પરસ્પર પ્રત્યેની ઉદાસીનતા કે ફૂટાઈને ચાલવાથી ન જ ઊકલે.

- २०. चंद्रकान्त महेता

(શ્રી ભદ્રકર વિદ્યાધીપક જ્ઞાન-વિજ્ઞાન વ્યાખ્યાન-શ્રેષ્ઠીમાં આપેલા વ્યાખ્યાનના અંશો)

(ਬੀਜ ਪਾਨਾਨੂੰ ਚਾਲ੍ਹ)

પર ટકાવી રાખવાનું પસંદ કરીને વ્યાજના દરને યથાવત્તુ રાખે અથવા તેમાં અલ્ય વધારો કરે તો ભાવવધારાનો ઉંચો દર ચાલુ રહે અને સરકારને લોકોના અસંતોષનો સામનો કરવો પડે. સરકારનો પ્રયાસ રાષ્ટ્રીય ઉત્પાદનના ઊંચા વૃદ્ધિદરને જાળવી રાખીને ભાવવધારાને ડામવાનો છે. તેથી ફુગાવાને કાબૂમાં લેવાની બાબતમાં તે સાવચેતીપૂર્વક આગળ વધી રહી છે.

- २८६


ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટનાં પ્રકાશનો

શ્રી કસ્તુરભાઈ લાલભાઈ વિધાવિસ્તાર ગ્રંથશેણી



- (૧) ગાંધીચરિત (શ્રીજ આવૃત્તિ), ૧૨૦ રૂ. (૨) કેન્સર (ચોરી આવૃત્તિ), ૧૫૦ રૂ.
 (૩) નાટક દેશવિદેશમાં, ૧૩૦ રૂ. (૪) ભારત : પ્રતિભા અને પરિદર્શન, ૫૦૦ રૂ.
 (૫) સિદ્ધાન્તસારનું અવલોકન, ૭૦ રૂ. (૬) નાટ્યતાલીમના નેપથ્ય, ૧૨૦ રૂ. (૭) સંખ્યાઓની સુષ્ઠિ, ૮૦ રૂ.
 (૮) શાનાંજન-૧, ૨૦૦ રૂ. (૯) શાનાંજન-૨, ૨૫૦ રૂ.

શ્રી ગંભીરચંદ ઉમેદચંદ શાહ વિશ્વવિદ્યા શેણી



- (૧) જીનીનિર્ણયશાસ્ત્ર (Genetics), ૬૦ રૂ. (૨) લોકવિધા-પરિચય, ૧૦૦ રૂ.
 (૩) આપણાં રાષ્ટ્રીય પ્રતીકો, ૮૦ રૂ. (૪) લિપિ, ૩૦ રૂ. (૫) ભૂમિતિ : સ્વરૂપ અને પ્રકાર, ૮૦ રૂ.
 (૬) તરસ્યા મલકનો મેઘ, ૧૫૦ રૂ. (૭) શબ્દનું સાચ્ચ, ૨૦૦ રૂ. (૮) શાહીડ વિનોદ ડિનારીવાલા, ૮૦ રૂ.
 (૯) જાંબુરિયા રંગનું કૂલ અને બોજાં, ૮૦ રૂ. (૧૦) તળની બોલી, ૧૩૦ રૂ.
 (૧૧) વિશ્વનું શિલ્પ-સ્થાપન્ય, ૨૦૦ રૂ. (૧૨) પૃથ્વીનો ભૂતસરીય ઈતિહાસ, ૨૦૦ રૂ. (૧૩) હિંદી મહાત્માગર, ૧૬૦ રૂ.

ધન્ય ગુર્જર્ટી કેન્દ્ર



- (૧) ગુજરાત (શ્રીજ આવૃત્તિ), ૪૦૦ રૂ.
 (૨) Gujarat, ૬૫૦ રૂ.

શ્રી કાન્તિભાઈ ટાકર જ્ઞાનવર્ધક ગ્રંથશેણી : ૧



- (૧) સત્યની મુખોમુખ, ૩૦૦ રૂ.

ગુજરાતી ભાષા, સાહિત્ય અને
એની અભિવૃત્તાને ઉજાગર કરતો

ગુજરાતી વિશ્વકોશ

ખંડ - ૧ થી ૨૫

૧૦૦૦ પાનાંનો એક રોવા ૧ થી ૨૫ ગ્રંથો
(‘આ’ થી ‘ણ’ સુધી)માં ૧,૭૦૦થી વધુ વિદ્યાનો અને
લેખકોએ લખેલાં ૧૬૮ વિષયનાં
૨૩,૦૦૦થી વધુ લખાણોનો સમાવેશ.

સવા કરોડથી વધુ શાદીસંઘયા
અને અધ્યતન માહિતી ધરાવતો
પ્રમાણભૂત વિશાળ જ્ઞાનસંઘય.

દરેક સંસ્થા, ગંથાલય અને
વ્યક્તિઓ વસાવવા જેવી ગુંથશોધી

વિવિધરંગી વાચનસામગ્રી ધરાવતા
ગ્રંથ ૧ થી ૨૫ સુધીની
આ શૈશીની હિંમત

રૂ. ૨૦,૮૦૦/- છે,
લે રૂ. ૧૫,૬૦૦/- માં મળશે



ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, અમદાવાદ